

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination
March/April-2024 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	GST શું છે? ભારતમાં તેની જરૂરીયાત શું છે?	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૧	(A) પરોક્ષ કરની વિશેષતાઓ સમજાવો.	(૧૦)
	(B) પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર વચ્ચેનો તફાવત	(૧૦)
પ્રશ્ન.૨	જીએસટી હેઠળ- ધ્યાનમાં લીધા અને ધ્યાનમાં લીધા વિના પુરવઠાના ખ્યાલને સમજાવો?	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૨	(A) "સંયુક્ત અને મિશ્ર પુરવઠો" સમજાવો.	(૧૦)
	(B) "વિચારણા વગર પુરવઠો" સમજાવો.	(૧૦)
પ્રશ્ન.૩	ફોરવર્ડ (આગળ) ચાર્જ હેઠળ સેવા માટે સપ્લાયનો સમય સમજાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૩	રિવર્સ (પાછળ) ચાર્જ હેઠળ માલ માટે સપ્લાયનો સમય સમજાવો.	(૧૫)
પ્રશ્ન.૪	સપ્લાયના મૂલ્ય એટલે શું? વ્યવહાર મૂલ્યમાં કઈ વસ્તુઓ શામેલ છે?	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	સપ્લાયના મૂલ્ય હેઠળ એજન્ટ અને વ્યક્તિ શબ્દ સમજાવો.	(૧૫)

ENGLISH VERSION

Que.1	What is GST? What is its need in India?	(20)
	OR	
Que.1	(A) Explain the features of Indirect Taxes	(10)
	(B) Difference between Direct Tax and Indirect Tax	(10)
Que.2	Explain the concept of supply with and without consideration under GST?	(20)
	OR	
Que.2	(A) Explain "Composite and Mixed Supplies"	(10)
	(B) Explain "Supply without consideration"	(10)
Que.3	Explain the Time of supply for service under forward charge	(15)
	OR	
Que.3	Explain the Time of supply for goods under reverse charge	(15)
Que.4	What is meant by value of supply? What items are included in transaction value?	(15)
	OR	
Que.4	Explain the term Agent and Person under value of supply	(15)
